



લોકભાષાઓ પર મહાભારતનો પ્રભાવ

પરબત એચ. ડાભી

આસિસ્ટન્ટ પ્રોફેસર

સંસ્કૃત વિભાગ

એમ.એન.કોલેજ, વિસનગર.

ભારતીય સાંસ્કૃતિક વાઙ્મયમાં મહાભારતનું મહત્વ અતુલનીય છે. જો કે રામાયણની જેમ જ એમને આર્થકાય માનવામાં આવે છે. વીતી ગયેલ ૧૫–૨૦ શતાબ્દિઓથી હિન્દુ સમાજના ક્ષિદ્યમાં એમનું અવિરાજ્ય છે. મહાભારત કવિઓનો ઉપકાય ગ્રન્થ છે. વ્યાસે કહું છે;

{ it Has off mad Smad \j ayN te kiv bñm }

ઈ.સ.પૂર્વ બીજી સદીથી માંડીને આજ સુધી સંસ્કૃત, પાકૃત તથા અન્ય પ્રાદેશિક ભાષાઓના સાહિત્યકારોએ મહાભારતમાંથી પ્રેરણા લઈ કાવ્ય, નાટક, ચર્ચા વગેરે વિવિધ પ્રકારના ગ્રંથોની રચના કરી છે. પતંજલિ મુનિના મહાભાષ્યમાં ks v6 અને bil KN6 આ બે નાટકનો ઉલ્લેખ દર્શાવવામાં આવે છે. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દિમાં મહાકવિ ભાસે પણ નાટકો લખ્યાં હતાં. ૭૩ નાટકોમાંથી ૬ નાટકો મહાભારત પર આધારિત છે.

કવિ કુલગુરુ કાલિદાસના બે નાટક ivkñovxIyR અને Aiw) anXaakNal m\ માં પણ મહાભારતને ઉપકાય ગ્રન્થ માનવામાં આવે છે. આ રીતે મહાભારતને આકારગ્રંથ માનીને નિર્ભિત રચનાઓની સંખ્યા અતિ વિસ્તૃત છે અને ઈ.સ.પૂર્વ બીજી સદીથી શરૂ કરીને xB:garvad ૧૫મી સદી સુધી અવિચિન્ન રહે છે. આ ગ્રંથોમાં નાટક છે શિશુપાલવધારિ કાવ્ય છે, તેથી જ નલચર્ચ ભારતચર્ચ વગેરે ગંધપદમય ચર્ચા વગેરે પણ છે. આમ, સાહિત્ય પર જોઈ શકાય તેવો મહાભારતનો સ્પષ્ટ પ્રભાવ છે.

લોકભાષા પર જનમાનસના વિચારો પર તથા વિશ્વાસ પર મહાભારતનો જે ગઢરો પ્રભાવ પડ્યો છે, તે પણ વિચારવા લાયક બાબત છે. આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે, કેટલાંય અર્થાલંકાર એ વાતની પુષ્ટિ આપે છે. સ્વાભાવોક્તિ, ગુઠોક્તિ, વ્યાજોક્તિ, વિવૃતોક્તિ, છોક્તિ, વક્ષોક્તિ તથા લોકોક્તિ – આ અલંકારોનું અવાચ્ય દીક્ષિતકથિત લક્ષણ વિચારણીય છે. મહાભારત આપણી સંસ્કૃતિ અને સભ્યતાનું અભિન અંગ બની ગયું છે. આ કારણે આપણી વિભિન્ન ભાષાઓના મુહાવરામાં કહાવતોમાં, સુવચનોમાં જ્યાં ત્યાં મહાભારતનું વ્યક્તિ વિશેષ પ્રતિબિંબિત થયેલું જોવા મળે છે. કહેવામાં આવે છે કે અનુભવરૂપી સાગર થોડા શબ્દોમાં ગાગરમાં સમાય જાય તો લોકોક્તિ બની જાય છે.

કહાવત શબ્દ k4avt \ સંસ્કૃત શબ્દનું પાકૃત રૂપ છે. મહાભારતના રચનાકારોના રૂપમાં ભલે વ્યાસમુનિ, વૈશંપાયન તથા સૌતિનું નામ લેવામાં આવે છે. પરંતુ મહાભારત પર આધારિત લોકોક્તિયો પર કોઈપણ કર્તાની છાપ નથી.”A proverb is a saying without an author અથવા proverbs are wisdom of street”. આ ઉકિતાઓ અર્થ છે. આ રીતે તો લોકોક્તિઓનું વર્ગીકરણ પ્રમુખ પાંચ ભાગોમાં કરવામાં આવ્યું છે. (૧) કથાત્મકતા (૨) સર્વકારિતા (૩) દેશિકતા (૪) વિષયસંબંધી (૫) સંસ્કૃતનિષ્ઠ. ઇતાંપણ આજે મહાભારત પર આધારિત લોકોક્તિયોનો વિચાર માત્ર બે મુખ્ય મુદ્દાઓ પર કરવામાં આવે છે. (૧) વ્યક્તિનિષ્ઠ (૨) પ્રસંગનિષ્ઠ

વ્યક્તિનિષ્ઠ લોકોક્તિ

લોકભાષાઓનું સાંસ્કૃતિક વિકાસમાં મહત્વનું સ્થાન છે એમાં પણ લોકોક્તિયોને અક્ષમ ભંડારનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. એમાં માત્ર પુસ્તકીયું જ્ઞાન નથી, પરંતુ અનુભવસિદ્ધ બાબત હોય છે. જે સંક્ષિપ્ત છે, છતાંપણ પ્રભાવશાખી છે.

કાવ્ય લક્ષણો અનુસાર એમાં કયારેક અતિવ્યાપિન અને અવ્યાપિન દોશ પણ થઈ શકે છે, છતાં પણ એમની સારગર્ભિતતા, વ્યાખ્યાત્મકતા, અને સજ્જવતાને કોઈપણ બરાબરી કરી શકતું નથી. *yidhaiSt tdNy5 yNnhaiSt n t t\ Kvict |* વ્યાસની આ ઉકિત પ્રમાણિત થાય કે જગતમાં જે કોઈ વસ્તુ જોવા મળે છે તે મહાભારતમાં જોવા મળે છે. આ ગ્રંથમાં અનેકવિધ પાત્રોને પોત પોતાની વિશેષતાઓ છે. પાત્રવિશેષનો સ્વભાવ, કાર્ય, જીવનશૈલી શારીરિક તેમજ માનસિક ગુણાદોષ વગેરે બાબત પરવર્તી સમાજે આત્મસાત કરી એ બાબતનું ભાષિક અધિષ્ઠાન આપ્યું.

અગર કોઈ વ્યક્તિ ખૂબ જ કઠિન પ્રતિજ્ઞા કરે છે તે આજે પણ ભીષ્મપ્રતિજ્ઞા કહેવાય છે. આ જન્મ બ્રહ્મચર્યનું વ્રત પિતામહ ભીષ્મએ નિભાવ્યું. પોતાના પિતા આપેલ વચનાનુસાર અને તેજ એક આદર્શ બન્યો. અત્યંત દાની વ્યક્તિને કર્ષણો અવતાર માનવામાં આવે છે. ખૂબ જ ખાનારને બકાસુર કહેવામાં આવે છે. ગાન્ધારરાજ શકુનિ ધૂર્તતા અને કપટનીતિનો પુરસ્કર્તા માનવામાં આવે છે. પાંચાલી દ્રોપદીની ગણના પ્રાતઃસ્મરણીય પતિત્રતા સ્ત્રીઓમાં કરવામાં આવે છે. કાલી, કરાલ અને વિકરાલ સ્ત્રીઓ હિંદિમ્બા કહેવામાં આવે છે. મહાભારતનો નાયક યુદ્ધિષ્ઠિર સંપૂર્ણ મહાભારતમાં એક ક્ષમાશીલ વ્યક્તિના રૂપમાં જ વાચકોની સામે આવે છે. કયારેક કયારેક તો હદની બહાર શાંતિને અપનાવવામાં વાચકોને ગુસ્સો પણ આવે છે. કિરતાર્જુનીયમના પ્રથમ સર્ગમાં માનિની અગ્રશિખા દ્રોપદીના જાજરમાન ભાષણ ભીમસેનને સમજાવવામાં નાકામયાબ નિવડે છે. તો વાચક પણ *j 3azr s n\j hali pavkm* આ શબ્દોમાં ધર્મરાજ યુદ્ધિષ્ઠિરની નિંદાની તુલના કરવામાં આવે છે. અર્થાત અહીં પણ ધર્મરાજ શબ્દ ગૌરવદર્શક નથી, પરંતુ અપમાનદર્શક છે.

મહાભારતમાં ધૂતરાષ્ટ્રનું અંધાપન માત્ર આંધિક નહીં, માત્ર દ્રષ્ટિ વૈકલ્પ નથી, પરંતુ પુત્રમોહમાં ધર્માધર્મવિવેકને ભૂલાવનાર વૈચારિક દાઢિહીનતા પણ છે. એટલા માટે જ્યારે પુત્ર પ્રેમને સર્વોચ્ચ સ્થાન આપીને જ્યારે વ્યક્તિની સારા નરસાનો નિર્ણય કરી શકતો નથી, ત્યારે તેને ધૂતરાષ્ટ્ર કહેવામાં આવે છે. મહાભારતની અધતનીય રાજનીતીમાં એમનું ઉદાહરણ આપવામાં આવે છે. કહાવત સમગ્ર માનવ વ્યહવારને સમેટી લે છે. સારી સલાહને વિદુરનીતી અને કપટપૂર્ણ સલાહને કણિકનીતિ કહેવું અત્યંત સાધારણ બાબત છે. આ પ્રયોગ પહેલા કયારે થયો, કોણે કર્યો એમનું કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી. કહેવતોનો ભંડાર વેદોની જેમ અપૈરૂષેય છે અને આ વર્તમાન પેઢીને પૂર્વજોથી ઉત્તરાધિકારના રૂપમાં પ્રાપ્ત થાય છે.

પ્રસંગનિષ્ઠ લોકોક્તિ

મહાભારતના અનેક પ્રસંગોમાં કહેવાયેલ ઉકિતઓના પિતા છે. જેમ કે જે ઘરમાં ભાઈ ભાઈ વચ્ચે બનતું નથી તે ઘરને કુરુક્ષેત્ર તરીકે બતાવવું યોગ્ય છે અને તે ઘરમાં મહાભારત થઈ રહ્યું છે એવું પણ સાર્વત્રિક છે. દ્રોષાચાર્ય પોતાના શિષ્યોની પરીક્ષા લીધી. પત્રપુષ્પફલાન્વિત વૃક્ષ પર પક્ષીની મૂર્તિ મૂકીને એક વિદ્યાર્થીને બોલાવીને કહું અને વૃક્ષ પર શું દેખાય છે એવું પૂછ્યું. બધા કોરવ-પાંડવોએ વૃક્ષના અંગોનું વાણન કર્યું. કેવળ અર્જુને જ કહું કે મને ફક્ત પક્ષીની આંખ દેખાય છે. આ પ્રસંગ પર આધારિત લોકભાષાઓમાં કહેવાવા લાગી કે પક્ષીની આંખ જોવી અથવા એકાગ્રતા, સુક્ષમક્ષિત્વ વગેરે લોકોક્તિ છે. ધર્મક્ષેત્ર પર યુદ્ધના કારણે ઉપસ્થિત ગુરુજન, સગાસબંધી અને ભાઈઓને જોઈ અર્જુન હતોન્તસાહ અને જ્વાનિ અનુભવે છે. દ્વિધામાં પડી જાય છે કે આ પ્રસંગમાં શું કરવું. જીવનમાં દરેક વ્યક્તિને આ પ્રકારની વિવશતા કે માનસિક અંતદ્વાન્ધનો અનુભવ થાય છે. કર્તવ્યાકર્તવ્યના સંદર્ભમાં વિમૂઢ થઈ જાય છે, ત્યારે એવું કહેવામાં આવે કે આની રિસ્થિતિ અર્જુન જેવી થઈ ગઈ છે.

યુદ્ધપ્રસંગમાં દ્રોષાચાર્ય પૂર્વ અશ્વત્થામા નામનો હાથી મરી ગયો હતો. શ્રીકૃષ્ણની સલાહથી યુદ્ધિષ્ઠિરે *ASvt4ama ht o ht:* એવું કહીને હલકા અવાજમાં *nro va kjiro va* કહું. ગુરુ દ્રોષાચાર્યને અશ્વત્થામાને હણાયેલ સાંભળીને શસ્ત્રત્યાગ કર્યો, આજે પણ જ્યારે કોઈપણ બાબત યથાર્થરીતે કહેવી અસંભવ અથવા અનુચિત હોય, ત્યારે બુદ્ધિ ભ્રમકારી વાતને કહે છે અને તેને *nro va kjiro va* ને અનિશ્ચિત બાબત માનવામાં આવે છે. શ્રીમદ ભગવદગીતાના અનેક સુભાષિત જેમ કે *yog: kmRukexl m\s\xyallna ivnXyit y467ais t4a krusTvalsJj ayte) ann\ n ih kLy\`k\k\c\cdgRa tat gC7it rj o ragalmk ivi^ vas ai^ j I^ am swvaim yge yge ma f\ esukdaen mank^ xr^ vj yog9m vhaMyhm* વગેરે પ્રસંગવશાત લેવામાં આવે છે. વક્તા કદાચ ભાષા વિષયક હો અથવા વિજ્ઞાનનો અથવા રાજનીતિશ હોય

કે વિધિજ્ઞ કલાકાર હોય કે શાસ્ત્રજ્ઞ પોતાના પ્રવચનમાં ભારતીય સંસ્કૃતનો મૂલસત્રોત મહાભારતના સુવિચારો કહેવાનું ભૂલશો નહિ **A4Sy prs o das** આ વાક્યમાં ભીષ્મ પિતામહે પોતાની અગતિકતાનું દર્શન કરાવ્યું હતું. **2mR0v hto hiNt** **2moR r(ait ri9t raj a kal Sy kar` m** વગેરે મહાભારતના અન્યાય પ્રસંગોમાં ઉપર્યુક્ત વચનો અનેકગણી વકૃતવ્યશૈલીને શોભાયમાન કરે છે.

મહાભારતના કેટલાક કથાપ્રસંગો જનભાષાઓ પર ખૂબ જ વધારે અસરકર્તા જણાય આવે છે. જથ્દ્રથવધનો પ્રસંગ મહાભારતમાં વર્ણિત છે, એવા સમયે સૂર્યગ્રહણના કારણે સૂર્યાસ્તની ભાવના બનીને જથ્દ્રથ નકામો અભિનાનના વ્યૂહથી બહાર આવ્યો અને એવા સમયે ગ્રહણ સમાપ્ત થઈ સૂર્યબિંબ દ્રશ્યમાન થવાને લીધે શ્રીકૃષ્ણની સલાહથી અર્જુન જથ્દ્રથના મસ્તકનું છેદન કર્યું. આ પ્રસંગના આધારે **Ha s yRha j y³4** એવી કહાવત બની ગઈ. સ્ત્રીઓના મુખમાં કોઈપણ વાત ગુપ્ત રહેતી નથી આ વાતનું કારણ પણ યુવિષ્ટિરે માતા કુંતીને આપેલા શાપમાં છે. પરસ્પરનો ઝગડો કરીને સર્વનાશ કરનાર ભાઈઓની લડાઈને **s NlOps NDII** કહેવું જ યોગ્ય છે, આ સિવાય સાધારણતા: રાજનૈતિક પક્ષોમાં ઝગડો થાય છે. તેમને પણ **s NlOps NDII** કહેવામાં આવે છે. અહી અર્થાન્તર સંક્ષિપ્ત લક્ષણનો પ્રયોગ સિદ્ધ થાય છે. મરાಠી લોકનાટ્ય પરંપરામાં **j ambli-AaQyan** અત્યંત પ્રસિદ્ધ કે લોકપ્રિય નાટ્ય છે અને તે દ્રોપદીના મનમાં કર્મ પ્રત્યેની જે અભિલાષા છે એના પર આધારિત છે.

જેવી રીતે કોઈ વંઘ્ય ચિત્રકાર પોતે બે ચાર લીટીઓમાં ખૂબ જ મોટો આશય પ્રસ્તુત કરે છે કે, જેમને વર્તમાનપત્રોના બે ચાર અગ્રલેખોમાં પણ સ્પષ્ટ કરી શકતું નથી, આ રીતે કહાવત તથા લોકોકિત શબ્દોના માધ્યમથી ખૂબ મોટો આશય સ્પષ્ટ કરે છે. લૉર્ડ બેકને કહું છે કે; The genius, wit and spirit of a nation are discovered in proverbs. કહેવતો દ્વારા માત્ર માનવાની પરખ થઈ શકતી નથી, પરંતુ તેમની સંસ્કૃતિ અને સભ્યતા પણ જાણી શકાય છે. આથી અંતે એવું કહી શકાય કે સંસારમાં એવી એકપણ વસ્તુ નથી, જે મહાભારતમાં જોવા મળતી નથી.

2moRcayRc kanec mo9ec wrtv8R: |
yNnHiSt t dNy5 yNafaiSt n tt\ki Ct ||

સંદર્ભગ્રંથ

1. તિવારી, ભોલાનાથ. બૃહત હિન્દી લોકોકિત કોષ સંપાદક
2. એજન, પૃષ્ઠ ૭૦ – ૨૦
3. કિરાતાર્જુનીયમ ૭ – ૪૪
4. ભારતીય કહાવત સંગ્રહ વિશ્વનાથ નરવાણે
5. કુવલયાનન્દ અપ્પય દિક્ષિત – નિર્ણયસાગર, મુંબઈ.
6. ઠક્કર, સી.એ.મ. મહાભારતનો સંસ્કૃત સાહિત્ય ઉપર પ્રભાવ